

Introduction

સોલ.

"ભાષાંતર કરનારનું કાયમ્બૂજ કવેના પ્રતેસ્થપી થવાને ઠેકડો તેના ભક્ત, તેના આજ્ઞાં કિતબેબક, તેના એકાંતેક મદ્રા થવાનું છે. જે ગ્રંથ ઉપર આપણી રહ્યેલે નથી એટલે જે તરફ આપણે સાનંદાશ્રયથી કેતા નથી તે ગ્રંથનું ભાષાંતર આપણે કદી પણ સાંદું કરી શકવાના નહીં, અને તે ગ્રંથનો કાવ્યનો હોણે, તો તો આપણો સધારો શ્રમ પાણીમાં જ જોણે એમ અગાઉથી જ જગતું ભાષાંતુરું કરનારે કયારે પણ પોતાના તરફથી ધરાડોવધારો કરવો ન એઈએ, કેમકે આપણે તેના વિચાર જગત્તા નથી બેઠા, પણ મુળગ્રંથકર્તા, જેની કીર્તિથી આપણે મોહિત થઈ ગયા છીએ તે શું કહે છે તે આપણે જગતું છે. એવે ઠેકડે ભાષાંતરકલાંથે પોતાનું હોન્ડાહુંયું કરવું તે એક જતની ઠગાઈ છે. જે ગુંગ, જે હોથ, જે છાટા, જે ભાષાની મિઠાશ ખુલ્લમાં દે તે સધારી ભાષાંતરમાં આવવી એઈએ. જો તે જ કાવ આપણી ભાષામાં લખવા એઠો હોય તો તે કેમ લણે. ભાષાંતરનું એ તો સંપૂર્ણ લક્ષ્ણ છે. માત્રસના કોઈ કાયમમાં સંપૂર્ણતા આવતી નથી, અને એ કાયમમાં તો આવે જ ક્યાથી? સંપૂર્ણગુણવાળું તો ક્યાથી પણ સાંદું કહેવાય લેલું ભાષાંતર કરવું બહુ અધીકું છે. હુંનામારાં થોડા જ કાવ્યનાં ભાષાંતરો, દેશપ્રય થયાં હો. નાં ગ્રંથ લખવા કરતાં પણ ભાષાંતર કરવું એ અનુભવી વેદવાનો બધારે વિકિત ગુણે છે. એ કાયમ એટલું • બધું વિકિત છે કે ભાષાંતર શી રીતે કરવું એ વાગ્યત એ પક્ષ પડી ગયા છે. કેટલાએક કહે છે કે શાફેશંદ જેમ હોય તેમ જ ઉતારવું અને કેટલાએક કહે છે કે ગમે તેટલો ફેરફાર કરવો પણ મુળનો રસ કાયમ રાખવો. રસ કે જે કાવ્યનો જીવ છે તો ઐશક કાયમ રહેવો જ એઈએ. કેમકે નહીં તો તે ફેરફાર હેવાનું બોણું છે, પણ તેમજ તેમાં જે વિચારો ઉપરથી રસ

ઉત્પન્ન થયો હોય તે વિચારોને પડતા મુક્તિ આપણે નવાજ
વિચારો દરમાલ કરીને કહાયે તેવો જ રચ જમાવી શક્તિએ,
તો પણ તે કોઈ રીતે ભાષાતીર કહેવાનું ન જ બેઠાયે. ભાષા
ભાષાની વાક્યરચનામાં ફેર છે માટે તે પાણત ગમે તેટલો
ફેરફાર કરવો, પણ ભાવાર્થ તો એક રહેવો બેઠાયે એમ જમારો
પક્કો વિચાર છે. જીસ્કૃત સરળી શાસ્ત્રીય ભાષામાંથી
તો તર્જુમો કરતી વળતે આ પ્રમાણે કરવાની વધારે જરૂર છે.
કેમકે તેમાં દરેક શાખ સાર્થક, અને અનેકવાતની વ્યાજના કરવાનાર
હોય છે. એમાંનો એકાદ શાખ અથવા ભાવાર્થ હોડી દીધો
તો તે એક સર્વીંગસ્ટુદર મુર્ત્તિનું અલયવર્ણિતન કરવા સરળું થઈ પડે
છે. ઉમેરીને વધારે રસીક કરવાની આશા રાખવા કરતો તો
મોરને ચીતરવા અને ગુલાયને કરતુરીનાપટ દેવા જરૂર એ
વધારે સાઠું છે. દરેકો અર્થ નાગણ્યાં વરાયાર પ્રગટ કરવામાં
તો જીસ્કૃત કાવણો એટલે જેને કાવ્ય કહે છે તેના કર્તાઓ અમને
સર્વોપારાલાગે છે. અર્થાત જીસ્કૃત કાવ્યના ભાષાતીરમાં વધધાર
કરવા જરૂર એ રણની હાનિ જ કરવા વરાયાર છે. વાક્યરચનામાં
ગમે તેટલો ફેરફાર કરો, એક શાખનો અર્થ બતાવવામાટે ગમે
તો એક વાક્ય વાપરો, તેમાં ને વાતની વ્યાજના કીધી હોય
તેનું કહાયે સ્ફોટીકરણ કરો ઈત્યારિ, પણ તેના અર્થમાં
પોતાનું પદ ન ઘેરો માટે ફેરફાર કરવો એ ઓછું જ...." •

- નવલરામ લક્ષ્મીરામ પંડુયા.

નવલગ્રંથાદાદિ^{લિખાયું} ૧૯૭૧ - ૧
નવલગ્રંથાદાદિ^{લિખાયું} ૧૯૭૧ - ૩૦

: ૨:

"ભાષાન્તર એટલે આચ્ય ભાષા. ભાષાન્તરની પદ
કૃતને અગે ભાષા પદટો થયો છે. એ બાહ્ય હકીકત ઉપર ભાર
મુકે છે. અનુવાદ એટલે મૂળની. પાણી પાણી - મૂળને અનુસરીને

બોલવું તે. અનુવાદ શયદ ભાષાન્તર કેવી રીતે થયું તેની અંતરપ્રાક્ષય લ્યાર્ડ લક્ષ્ય હોય છે. કૃતિની ભાષા પદ્ધતાય એટલું જ પુરું નથી. મુજા કૃતિનો જે અવાજ હૈ તે જીવાવો બેહિયો. દરેક અનુવાદ ભાષાન્તર તો હુણે જ, દરેક ભાષાન્તર અનુવાદ હુણે જ ઐમ નુકાની શકતાચ.

"..... કાવિતામાં ઉત્તમ શયદો તિત્તમ ક્રમમાં હોય રે. એ શયદ પર્સિફળ અને એ ક્રમપર્સિફળિથી ઉત્પન્ન થયેલો છિદ્ગોલય એ કાવ્યનું જવાનુભૂત તત્ત્વ હેઠાં એમ કહીએ તો ચાલે. ભાષાપલટો કંકવા, જતાં જ એ મુજનો લય તો લય પામે છે. ખંડુ બેતાં તો કૃત ગવમાં હોય કે પદ્ધમાં હોય, પરા એ કલાકૃત હોય તો તેનો અનુવાદ એ વિશેષ પ્રદાન ઉપરથી કરે છે. દરેક કલાકૃત એ પ્રતીભાવાન ભાષાને થયેલા દર્શનની અભિવ્યક્તિ હૈ, જ્યારે એને બીજી ભાષામાં ઉત્તારનારને માટે કોઈ દર્શનનો કે એ દર્શનને અભિવ્યક્તિ અર્પવાનો સવાલ જ નથી. એ તો કદાચ એક શયદ માટે બીજી ભાષાનો શયદ ગોઠવવા જ એઠો હૈ! એની પાત્રાથી બીજી ભાષામાં જે સાધણ તે કલાકૃત તો રહેવા પામણે જ શી રીતે? ખારે જ, મુજાભાષામાં કલાકારની પ્રતીભાની જે મુદ્રા હોય છે તે બીજી ભાષામાં ઉપનવવી શક્ય જ નથી. શક્ય એટલું જ હૈ કે મુજા કલાકૃતનાં વધુમાં વધુ નજીક એવી કૃતિ આપવાં. અન્ય ભાષાનાં કલાકૃતને હ્રબ્ધભાષામાં ઉત્તારવા ઈચ્છનાર જેટલે અણે મુજા સર્જિકનો અમાનધમાં બનવા પ્રયત્ન કરશે તેટલે અણે મુજા કાવના અવાજને અનુસરીને અનુવાદ આપવામાં લેને સફળતા મળશે.

".... કાવિતાના અનુવાદ આંગેની સમયાં, દુકામાં એ છે કે મુજાકૃતિથી ભાષાન્તર - ભાષા પદ્ધતા.

કરતાં વાતાએ દુર ન જતું અને નવી ભાષાયાં મૌલિકતાની
દીપ્તિવાળી એક સ્વર્ત્ર કૃતિ તરીકે અને પગસર કરવી. આ
રીતે મહાકવિ બાળની કાશમ્યરીનો ભાલશનો ગુજરાતી
પદ-અનુવાદ એ સફળ અનુવાદ હે. : પૃ. ૧૧૧-૧૧૫:

"સમરલોકી અનુવાદની મુશ્કેલી રિધાડી હે.

ચાર પંચતમાં સમાચની ચુગવડવાળી ર્થેચૂત ભાષા જે ચુભરી
શકે તે આપણી ભાષા માટે, અમુક હદ સુધી ખમાસો યોગ્યતા
હોવા છતાં શાયા નથી; બધા જ ર્થેચૂત શાયદો ગુજરાતીમાં
તાજીસી તરીકે અપનાવવાનું પગ સુકર નથી. મુળવૃત્ત અને કથનને
વફાદાર રહેવા મય્યતા અનુવાદકોને જ્યારેકે કેટથી ક જતું કરવું
પડેલું હોય હે. નાનાલાલ જેવા, જે વૃત્તની લધુગુરુ ર્યેકલનાને
વળગી રહેતા નથી તેમને સુધી હે.... એના કરતાં વૃત્ત જે જ
બળવી કે. હ. ધૂંવ, બાલાશીકર આદ્દની જેમ ચાર પંચતમનો છ કે
અઠ પંચતમાં અનુવાદ રાપલો એ વધુ પાંદ કરવા જેલું હે.
સમરલોકીમાં છદ મય્યતાય એ ઠીક ન લાગે, એજ રીતે શાયદો
મય્યતાય એ પગ વરવું લાગે. : પૃ. ૧૧૬: સમરલોકીમાં પ્રાસ
મૈળવવાનો આગ્રહ, મૂળ ર્થેચૂતમાં એ છે નહિ ત્યારે, વધારાની
મુશ્કેલી નોિતરનારો ગગાય.

ર્થેચૂતવૃત્તો તેનાં તે વાપરવાનો આગ્રહ છોડી
દડાએ ત્યારે મૂળતું વાતાવરણ ભયવાય એવી
દંદપર્યાંગની હોવો એઈએ.... બાલાશીકરનો શકાર સોરઠો
લલકારે એ શોષે, બલવન્તરાયનો હુણ્ણન્ત જે સોરઠો લણે તો
કાઠી દરથારની ચાદ આપી યેસે.

- શ્રી ઉમાશીકર બેણી
કાવની સાધનાઃ પ્રવાનુવાદની
સમય. /પૃ. ૧૧૧ થી ૧૧૬માથી

• १३ •

સંચૂત કવિતાનું અમરણ કરતની રાખે કાલહાયની
રચનાનો સીધો બાળક તરી આવે છે. સંચૂત ભાષા કારે
છે એમ અહેવાન છે. એ કે એ અયાલ વરાયર નથી, પણ
કાલહાય વિષે જેટદું નિઃશબ્દપ્રે કલી શકાય કે બેમની વાણી
અનુસરણ, પ્રવાડી અને પ્રાણાદ્દ છે. કાલહાયની વિરવ્યાખન
જુઓના "મીતગોવંડ" કરતની જ્યે નહી મોટું જણી નાણે
શૈવી અતમધૂર નાંડ પણ સામચ્ચે અને માધુર્યનો એક વાંશે
પણ રચણ કરતનાની હોવ છે. જાં ચાહું લયકોશવ અને કવિત્વ-
કાળના અરમણિકર્ષ જાંબી, વસ્તુશોમં રહેવા કાંઈ કાને
પ્રશ્ન કરીહેતી ઉપયા ઉપરના અભાધારના પ્રશ્નાને બીજેં
કાલહાય બોગ્ય રીતે જ કવિકુલગુરુ દેખાયા છે. એ કવિઓ
એ, કાલહાયનો જીને, સંચૂત અને બીજી ભાષાઓની કાલ્ય-
સૌપણનો જાંબાં માલ્યો છે સેમીસિથી ધૂનાને મારી કેચ
થતું હોણે કે કાલહાયની કાલ્ય અદ્દેરી રચના
હોઠ શકે જરી : ૫. ૪૬:

મેધ્ય બાનોલે ચૌદી અખીય વિષે કે કહ્યું
હતું તે કાલજારને રાવથા લાગુ પડે હે. લેખને લાવનને કથ્યર
પણે કેદું હતું જને અખીયાઈમાં નેદું હ્રદ. : પૃ. ૪૭:

કંઈ તેને પૂર્વ ક્ષતિજ પણ હ્યો પુનઃ શશી
પ્રથમ હે સૂર્યને લખરણુરતો સેહા -હથી ?
અ-તો - કંઈ કોણાં હી - જુદુભદુસ મહે - મેલાં - કંઈ
કંઈ પ્રાણીના ઉદ્દિત ગરિદ્ધાં નખરાવિ
વનો કલ્લોલાલી હાથુરાસનો વેતન હથી ?
અ-માસાંતમે હથ્યા । સેયાં અલતરથ્યુ માનવતારુ,
શ હથ્યા । જીવી હેઠે, નરવધિ રસેનું શાનું આનું ?